

## સાધક જનો માટે વિવિકતા સ્થાનની આવશ્યકતા

એકાન્ત નિરૂપાધિક-નિર્જન સ્થાન જ સાધક જનો માટે અધિક ઉપયોગી છે. સહુ કોઈ શ્રેષ્ઠસાધક જનોને શરીરબળ, મનબળ અને હૃદયબળનું પોષણ આપનાર એકાન્તવાસ છે.

જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો જીબા થાય અને જ્યાં વસ્તવાથી સંયમ-ચોગમાં હાનિ પહોંચે, એવા સ્થળમાં નિવાસ કરવો-એવા ઉપાધિમય સ્થળ સમીચે વાસ કરવો એ સાધક જનો માટે હિતકર નથી.

**સમાધિશતકમાં વાચકવરે પૂ. ઉ. શ્રી ધરોવિ-  
જયજી કહે છે કે—**

“ હોત વચ્ચે મન ચ્યપળતા, જન કે સંગ નિમિત્ત;  
જન સંગી હોવે નહિ, તાતે સુનિ જગમિત.”

મનુષ્યોના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચ્યપલતા થાય છે અને તેથી ચિત્તવિભ્રમ થાય છે—નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે; માટે સુનિએ-ચોગીએ અજ્ઞાની મનુષ્યોનો સંસર્ગ તજવો. જે ચોગી-સુનિ મનુષ્યોના સંસર્ગમાં આવે છે, તે માયાના પ્રપંચમાં ફ્રસાય છે, અને માયાના પ્રપંચમાં ફ્રસાયાથી રાગદ્રેષની ઉત્પત્તિ થાય છે : અને રાગદ્રેષ લવનું મૂળ છે, માટે મનુષ્યોનો સંસર્ગ તજવો. જે સુનિરાજ મનુષ્યસંસર્ગ-

રહિત છે, તે સુનિ જગતના મિત્ર છે અને તે સુનિ ચાતાનું હિત સાધી શકે છે. પ્રાયઃ મનુષ્યના સંસર્ગથી ઉપાધિની પ્રાસિ થાય છે, માટે સુનિરાજ મનુષ્યોને સંસર્ગ ત્યાળી એકાંત સ્થાનમાં વસે છે. કારણું વિના વિશેષ પ્રકારે કોઈની સાથે ભાષણું પણ કરતા નથી. જે મનુષ્યોના પરિચયથી આત્માનું હિત નથી થતું તેમનો પરિચય કેમ કરે? બ્યાખ્યાન-શિક્ષાહિ કારણું મનુષ્યોના સંખાંધમાં આવે, તો પણ અંતરથી ન્યારા વર્તે છે. એવા સુનિરાજ ઉપાધિરહિત હોય તે અતુપમ આનંદના લોળી બને છે.

દોષપરિચય-ગૃહસ્થ દોકો સાથે નિકટ સંખાંધ જેડી રાખતા સ્વહિતસાધક સાધુજ્ઞનોને સંયમમાર્ગમાં ઘણી આડ-ઘીલી નડે છે-ઓલી થાય છે. ગૃહસ્થજ્ઞનોનો-ખીપુરુષોનો અધિક પરિચય કરવાથી સાધુચોણ્ય સમલાવ-સમતા ટકી શકતી નથી, એટલે રાજ-દ્રેષ-મોહાહિ દોષો જીપજે છે, વિષયવાસના પણ કુલચિત્ત જાગે છે અને શાંત, ધ્યાન, અદ્વાચર્ય વિગેરે અનેક અમૂલ્ય ગુણુરત્તનો દોપથાય છે. એટલે સાધુ સહેલે સત્ત્વહીન-શિથિલાચારી થઈ જાય છે.

“મૂળ સુનિ જે આત્મગવેષી, ન કરે ગૃહસ્થનો સંગ,  
જીહાં પરિચય તિહાં અવજા, થાયે સમકિત લંગ.”

(કુમારપાળ રાસ-કંપભાસ કવિ)

અદ્વાચર્યવંત સાધુજ્ઞનોને બગવંતે જે નવ વાડો અદ્વાચર્યની રક્ષા માટે પાળવા કરમાંયું છે, તે નવ વાડોમાં સુખ્ય વાડ એ છે કે-નિરવધ-નિહોંષ-નિરૂપાધિક (ખી, પણ, પંડક, નમુસક વિગેરે વિષયવાસનાને જગાડનારા કારણો વગરના) સ્થળમાં જ વિવેકસર નિવાસ કરવો, જેને

‘વિવિકૃત શાયા’ કહેવામાં આવે છે. પૂર્વકળના મહાપુરુષો એવા જ સ્થળને પસંદ કરી ત્યાં જ જ્ઞાન-ધ્યાનમાં પોતાનો સમય પસાર કરતા. વર્તમાનમાં મોટા લાગની સ્થિતિ ગૃહસ્થોના ગાઠ પરિચયવાળી ઉપાધિ સદ્ગુરૂ હોએ અભૂત સુધ્યારની વિચારણા માણી લે છે. સંયમવંત સાધુજ્ઞનોએ પ્રથમ આત્મસંયમની રક્ષા તથા યુષ્ટિ નિમિત્તે ઉક્ત હોષ વગરની-નિરોધ અને નિરૂપાધિક એકાન્ત વસતિ-નિવાસસ્થાન પસંદ કરવા ચોય છે. એથી સ્થિર-શાન્ત ચિત્તથી જ્ઞાન, ધ્યાન વિગેરે સંયમકરણીમાં ઘણી અનુકૂળતા થાય છે. તે કરતાં અન્યથા વર્તવાથી, તથા અકારના ઉપાધિ હોષવાળા સ્થાનમાં વસવાથી મન-વચનાહિક ચોગની સ્ફુરણના થઈ આવે છે. એટલે કે-ગૃહસ્થલોકોના ગાઠ પરિચયથી તેમની સાથે નકામી અનેક અકારની વાતચીતમાં લાગ લેવાથી આત્મહિત નહિ થતાં સાધુજ્ઞનોને સંયમમાર્ગની રક્ષા થતી નથી. સંયમમાર્ગની રક્ષા અને યુષ્ટિ કરવાની પ્રબળ ઈચ્છાના ચોગે વિવક્તિ-એકાન્ત સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે.

આ બધી સાધકદશાની વાત થઈ. આડી જેમણે મન, વચન અને કાયાનું સમ્યગ્ નિયંત્રણ કરી હીધું છે અને જેમને સ્વરૂપરમણુંતા જ થઈ રહી છે એવા સ્થિરચોગિ અધિકારીની વાત જુહી છે. તેમને તો વન અને ધર સર્વત્ર સમલાવ જ પ્રવતો છે. કહું છે કે—

“ સ્થિરતા વાજુમન: કાયૈ-યેષામજ્ઞાગિતાં ગતા ।  
યોગિન: સમજીલાસ્તે ગ્રામેડરણ્યે દિવા નિશિ ॥ ”  
( શાનસાર અષ્ટક )

આવા સ્થિર યોગિને જ શામ અને અરણ્ય સરળું છે.

હવે આપણે નિર્જન-અનિર્જન સ્થાનસેવનના ગુણ-  
દ્રાષ્ટના વિવેચનમાં દૃષ્ટાંતપૂર્વક જરા જેહ લઈએ.

યુદ્ધિમાન સાધક પુરુષ સુખહાયી નિર્જન સ્થાનને  
સેવે છે. તે ધ્યાનમાં અને સંયમાલયાસમાં સાધનરૂપ છે  
તથા રાગ, દ્રેષ અને મોહને શાન્ત કરનાર છે.

જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મશાસ્કોનો  
અલ્યાસ કરવાનો છે તથા ધ્યાન કરવાનું છે, તેઓને મતુ-  
ધ્યાહિ સંસર્ગ વિનાનું સ્થાન ધર્યું ઉપયોગી છે. સંસારપરિ-  
ભ્રમણું કરવાથી જેઓ થાક્યા છે, કંટાળયા છે, આત્માનું  
ભાન શુલ્કધ્યાથી મેળવ્યું છે, મનને નિર્મણ તથા સ્થિર  
કરવાના સાધનો જાણી લીધા છે અને તે પ્રમાણે વર્તન  
કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મતુધ્ય, પણુ, સ્વી,  
નખુસકાહિ વિનાનું સ્થાન સુખહાયી છે.

મતુધ્યે ઉપરથી બધી વસ્તુનો ત્યાગ કર્યો હોય છે,  
અદ્વાર્ય પાળવાનો તથા કોધાહિ કૃપાયો ન કરવાનો નિયમ  
લીધો હોય છે, છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તો હોય  
છે. કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પણ નિયમ  
પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મનો થતો ઉદ્ઘય  
નિષ્ઠલ કરવામાં આવે છે અને તે દ્વારા કર્મનો ક્ષય થાય  
છે. પરંતુ નિમિત્તો બળવાન છે. નિમિત્તોને લઈને સત્તામાં  
પડેલા કર્મો ઉદ્દીરણુાર્થે થઈને જે મોડા ઉદ્ઘય આવવાના  
હોય તે વહેલા બહાર આવે છે. આ વખતે સાધકની જે  
પૂરેપૂરી તૈયારી ન હોય-ઉદ્ઘય આવેલ કર્મને નિષ્ઠળ કરવા

જેટલું બળ તેની પાસે ન હોય, તો ઉદ્દ્ય આવેલા કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ધાર્સ વિનાનાં સ્થાનમાં પડેલો અથ્રિ બાળવાનું કાંઈ ન હોવાથી પોતાની મેળે બૂજાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ હથાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું બળ ઓછું થઈ જાય છે અને આત્મબળગૃહિ વખતે ઉદ્દ્ય આવેલ કર્મ આત્મ-સત્તા સામે પોતાનું જેર વાપરી શકતું નથી.

જેમ ડોઈ બળવાન છતાં ગફકતમાં રહેલા રાજના શહેર ઉપર બીજો રાજ ચઢી આવે, એ વખતે રાજની પાસે લડવાની સામયોની તૈયારી ન હોવાથી, પોતાનો બચાવ કરવા આતર તે રાજ પોતાના શહેરના દરવાજ બંધ કરે છે અને અંહરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે અને શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજ પોતાના શત્રુ ઉપર એકી વખતે હવ્લો કરે છે અને શત્રુને હરાવે છે; તેમ આત્માની આગળ ઉપશમભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હોતું. તેવા પ્રસંગે મોહશત્રુ તેના પર ચઢાઈ કરે છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતના પ્રતિ, જપ, તપ, નિયમ, જ્ઞાન, ધ્યાનાદ્ધિના પ્રતો અહૃણું કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ-ક્રેષ-મીહાદ્ધિને પ્રગટ થવાના કારણે હોતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલા કર્મોનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મંણતારૂપ આત્મબળ વધારે

છે. આ વ્રતાદિ લેવાં તે મોહશત્રુની સામે કિલ્દો બંધ કરવા જેણું છે. કિલ્દો બંધ કર્યાથી કાંઈ શત્રુ ચાલ્યો જતો નથી કે શત્રુનો નાશ થતો નથી. તેની સામે ખૂલ્દી લડાઈ તો કરવી જ પડવાની છે : પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અસાવે મોહનો ઉપરથી જીવને ઓછા હોય છે અને તે વખતમાં રાજ જેમ લડાઈની સામથી મેળવી લે છે, તેમ આ જીવ ઉપશમભાવનું બળ વત, તપ, જ્યુ, ધ્યાનાદ્વિથી મેળવે છે. આ એકહું કરેણું બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉદ્ઘયમાં આવે છે, ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કર્મનો ઉદ્ઘય નિષ્ઠળ કરીને કર્મની નિર્જરા કરે છે. નવા કર્મો ન બાંધવા અને જુના સત્તાગત ઉદ્ઘય આવેલ કર્મો સમભાવે લોગવી લેવાં, તે કર્મના ઉદ્ઘયને નિષ્ઠળ કરવા બરાબર છે.

ભગવાન શ્રી મહાવીરહેવની માદ્રક ડેંડ આત્મા વિશેષ બળવાન હોય તો તે ઉદ્ઘય આવેલા કર્મોને લોગવી નિષ્ઠળ કરે, પણ તે સાથે સત્તામાં પડેલા કર્મોની ઉદ્દીરણું કરીને જે મોડા ઉદ્ઘય આવવાના હોય તૈને તે તે નિમિત્તો-વડે બહાર લાવી સમભાવે નિર્જરી નાંખે છે. આવા સમર્થ આત્માઓ માટે નિર્જન પ્રદેશમાં રહેવાનો હેતુ કર્મથી ઉરવાનો કે તે હઠાવવાના સાધનો પોતાની પાસે ઓછાં છે તે મેળવવા માટેનો નથી, પણ પોતાના કર્મક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધનોમાં મતુષ્ય વિશ્વરૂપ ન થાય-વિશ્વેપ કરનાર ન થાય તે હોય છે, અને તેટલા માટે પણ નિર્જન-સ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે.

પોતાના કાર્યની સિદ્ધિ માટે શ્રી શત્રુંજ્ય પર્વતની શુક્રમાં શુક્ર રાજ છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જનસ્થાનમાં રહ્યા હતા. શ્રી નેમિનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજુના પ્રહેશમાં રહ્યા હતા. પ્રભુ શ્રી મહાવીરહેવ પણ આત્મધ્યાન માટે શૂન્ય ઘરો, સમશાનો, પહાડો, શુક્રચો અને નિર્જન પ્રહેશવાળા વના-હિમાં રહ્યા હતા. મહાત્મા અનાથી સુનિ વૃક્ષોની ગીય અડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રિય સુનિ અને ગર્ભલાલી સુનિ પણ વનના શાન્ત પ્રહેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. આ શાન્ત પ્રહેશના અલાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિએ એણુક રાજના સુસુખ અને હુર્મુખ નામના હુતોના સુખથી પોતાની પ્રશંસા અને નિંદાના વચ્ચેનો સાંભળીને રૈદ્રધ્યાને સાતમી નરકનાં હલીયાં એકઠાં કર્યાં હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ અને શુક્રલ ધ્યાનને બહલે આર્ત અને રૈદ્ર ધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તોના ચેંગે તેમની ધ્યાનની ધારા બદલાઈ ત્યારે જ તેઓ કેવળશાન પામ્યા હતા.

ગીરનારજુની શુક્રમાં ધ્યાન ધરતાં શ્રી રહનેમિ સુનિના ધ્યાનની ધારા પણ શ્રી રાજમતીના નિમિત્તથી બદલાઈ હતી, પરંતુ શ્રી રાજમતીની આત્મજનગૃતિએ પાછા તેમને સ્થિર કર્યો હતા.

મહાત્મા શ્રી નંદીષેણુની ધર્મધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાઈ હતી, મહાત્મા હમસાર સુનિની આત્મ-ધારા પ્રાક્તણે ગામનાં ધરોની લંતિવાળો પાછલો તપેદો માર્ગ અતાવતાથી કોધના રૂપમાં બદલાઈ હતી.

આવા આવા સેંકડો દૃષ્ટાંતો સારા નિમિત્તોથી આત્મભળ જાગૃત થવાના અને ખરાખ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાના શાસ્ત્રોમાંથી મળી આવે છે, તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ; માટે સાધક આત્માને-આત્મચિંતન કરનારને નિર્જનસ્થાનની ખડુ જરૂર છે એ નિર્વિવાદ વાત છે.

સદ્ગુરુજી, સમલાલ, તત્ત્વાર્થનું અહણુ, મન-વચન-કાયાનો નિરોધ, વિરોધી નિમિત્તોનો અભાવ, સારા નિમિત્તોની હ્યાતિ, રાગદેખાહિનો ત્યાગ અને આત્મજાગૃતિ, એ સર્વ આત્માની વિશુદ્ધિના જેમ પ્રભળ નિમિત્તકારણો છે, તેમ આત્મચિંતન માટે નિર્જનસ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્તકારણુ છે.

જેમ ચંદ્રને દેખીને સુસુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃદ્ધિથી નહીએમાં પાણીનો વધારો થાય છે, મોહથી કર્મમાં વધારો થાય છે, અનિયમિત લોજન કરનારમાં રેણ વધે છે અને ધન્દ્રિયોના વિષયોમાં વિરોષ પ્રવૃત્તિ કરનારમાં હુઅનો વધારો થાય છે, તેમ મતુષ્યોના સંસર્ગથી વિકદદ્પોનો, આશ્રવવાળા વચનાનો તથા પ્રવૃત્તિનો વધારો થાય છે. જેમ લાકડાંથી અભિ વધે છે, તાપથી તૃષ્ણા અને ઉકળાટ વધે છે, રોગથી પીડા વધે છે, તેમ મતુષ્યોની સોભતથી વિચારો અને ચિંતા વધે છે.

વિષયોનો ત્યાગ, નિર્જનસ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિત મન, નિરોધી શરીર અને મન-વચન-કાયાનો નિરોધ-એ સર્વ મુનિઓને મોક્ષને અર્થે ધ્યાનના પ્રભળ નિમિત્તો છે.

વિકલ્પો દ્વારા કરવા સંગત્યાગની જરૂર છે. મનુષ્યોની સોભત કંઈ ને કંઈ સમરણું કરાવ્યા વગર રહેતી નથી. એકી સાથે વળગેલા વીધીઓ જેમ મનુષ્યોને પીડા ઉત્પન્ન કરે છે, તેમ વિકલ્પો આત્માને પીડા કરનારા છે. આ વિકલ્પો જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને શાંતિ કયાંથી હોય? જે ખાદ્ય સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે, તો પછી આત્માના સંગથી ખરું સુખ તેણે શા માટે ન લોગવલું? અજ્ઞાની જીવો ખાદ્ય વસ્તુના સંગથી સુખ માને છે, ત્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સુખ અનુભવે છે.

જેઓ નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સ્ત્રોધ્ય થતા અધ્યયન અને સાહૃદ્યાનદૃપ અસ્થિંતર અને ખાદ્ય તપ કરે છે, તે સુમુક્ષાઓને ધન્ય છે! તેઓ ગુણી છે, વંદનીય છે અને વિદ્ધાનોમાં સુખ્ય છે, કે જેઓ નિરંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મઝ થઈ નિર્જનપ્રદેશ સેવે છે. જ્ઞાનધ્યાનમાં વિક્ષિપન હોય એવા નિર્જનસ્થાનને સત્પુરુષો અમૃત કહે છે.

તે મહાત્માઓને ધન્ય છે, કે જેઓ લોંઘરામાં, શુક્રાયોમાં, સમુદ્ર યા સરિતાના કિનારે, સમશાનમાં, વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે.

આવા શાંત પ્રદેશના અલાવે યોગીઓને મનુષ્યોનો સમાગમ થાય છે. તેમને જેવાવડે અને વચ્ચનથી જોતવાવડે મનતું હલનયલન થાય છે. તેમાંથી રાગદ્રેષાહિ પ્રગટે છે, કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિનો નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિદ્રૂપતું ચિંતન બરાબર થતું નથી અને

તેના વિના કમોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિએ બહાર આવતી નથી. માટે જ વિવિક્તા સ્થાન કલેશનું નાશ કરનાર અને સુમુક્ષ યોગીએને પરમ શાંતિનું કારણ છે, એમ મહાત્માએએ સ્વીકારેલું છે.



## પરદ્રવ્યસ્વરૂપ વિચારકર્તાવ્ય

પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે, અને સ્વરૂપ સમજયા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અથવા અસુક અંશે સમજયાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થી વિષે રમણુ કરવા હાડે છે. ત્યારે પરદ્રવ્ય કે નેતું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજયા માંડતાં વૃત્તિને પાછી અંતરમાં લાવવી પડે છે અને તેમ લાભ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર હોઇવા માંડે છે, ત્યારે જ્ઞાનું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માને અનુભવ વખતે થઈ જાય છે. જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણુતિરૂપ થઈ પરિણુમે છે અને તે પ્રમાણે પરિણુભવાથી આલ્ય પહાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે.